

# ગુજરાત જાહેર સેવા આયોગ

રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી

:સુધારા યાદી:

- વંચાણે લીધી:(1) આયોગની તા.17.05.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી  
(2) આયોગની તા.21.02.2018ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની બીજી યાદી  
(3) આયોગની તા.02.04.2018ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની ત્રીજી યાદી  
(4) આયોગની તા.21.04.2018ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની ચોથી યાદી  
(5) આયોગની તા.17.05.2018ની રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી

1. જુનિયર નગર નિયોજક, વર્ગ-2ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 45/2016-17ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.01.01.2017 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર થતા કુલ: 163 ઉમેદવારોની યાદી આયોગની કચેરી દ્વારા તા.17.05.2018ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

2. આ જગ્યાની જાહેરાત તા.18.10.2016ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તથા તેમાં ઓન-લાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:03.11.2016 નિયત થયેલ છે. આ જગ્યાની જાહેરાતની શૈક્ષણિક લાયકાતની જોગવાઈ અનુસાર, (1) Possess a degree in Architecture or Civil Engineering obtained from any of the University or an institution established or incorporated by an act of the parliament or state legislature in India or an institution declared to be deemed as University under section 3 of the University Grants Commission ACT, 1963 (3 of 1956) or an equivalent qualification recognised as such by the Government or possess an equivalent qualification recognised as such by the Government;

(2) Possess a post graduate degree or Diploma in city planning or town planning or traffic and Transportation planning or Regional planning or urban planning or Infrastructure planning or Industrial planning obtained from any of the University or an institution established or incorporated by an act of the parliament or state legislature in India or an institution declared to be deemed as University under section 3 of the University Grants Commission ACT, 1963 (3 of 1956) or an equivalent qualification recognised as such by the Government or a membership obtained by an Examination of Institution of town planners of India. ની લાયકાત ધરાવતો હોવો જોઈએ. તદાનુસાર ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: 03.11.2016ના રોજ ધરાવતા હોવા જોઈએ.

3. આયોગની કચેરી દ્વારા તા.17.05.2018ના રોજની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં સમવિષ્ટ નંબર.101000283 પરના ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત જાહેરાતની છેલ્લી તારીખ:03.11.2016ના રોજ ધરાવતા નથી.
4. આથી રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના બેઠક નંબરની યાદીમાંથી બેઠક નંબર: 101000283 ને રદ કરી આ યાદી હેઠળની નોંધ: (1) “આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોઈ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.” માં સમાવેશ કરવામાં આવે છે.
5. આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નિયત નોર્મ્સ મુજબ રૂબરૂ મુલાકાત માટે બિન અનામત (કોમન) વર્ગની કુલ: 25 જગ્યાઓ સામે 75 ઉમેદવારો ને રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના થાય છે, આથી બે.ક.101000283 પરના ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણતાં બિન અનામત (કોમન) વર્ગના મેરીટ મુજબના બે.ક.101000061 પરના ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવે છે. હવે અનુ.જાતિ (કોમન) વર્ગનું લાયકી ધોરણ બિન અનામત (કોમન) જેટલું રાખતાં અનુ.જાતિ (કોમન) વર્ગના બે.ક. 101000431 પરના વધુ એક ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવે છે. અને યાદી હેઠળની નોંધ: (2) “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે, પરંતુ આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા ન હોઈ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.” માંથી રદ કરવામાં આવે છે.
6. આમ થતાં રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની કુલ સંખ્યા: 164 અને આ યાદી હેઠળની નોંધ: (1) હેઠળની કુલ સંખ્યા: 119 તથા યાદી હેઠળની નોંધ: (2) હેઠળની કુલ સંખ્યા: 1 થાય છે. આયોગની કચેરી દ્વારા તા.17.05.2018ના રોજ પ્રસિધ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

સ્થળ: ગાંધીનગર-382010  
તારીખ: 19.05.2018

Sd/-  
સંયુક્ત સચિવ  
ગુજરાત જાહેર સેવા આયોગ